

DOLAT INVESTMENTS LIMITED

Corporate Office: 301-308, Bhagwati House, Plot A/19, Veera Desai Road, Andheri (West), Mumbai- 400058

Tel.: 91-22-2673 2602/03/04/5570 4167/68/69/71 Fax: 91-22-26732642,

Corporate Identity Number: L67100DD1983PLC004760

Website: www.dolatinvest.com, E-mail: post@dolatinvest.com or grievances@dolatinvest.com

08th September, 2021

To,
Listing Department
BSE Limited
Phiroze Jeejeebhoy Towers,
Dalal Street, Fort,
Mumbai 400 001.
BSE Code: 505526

Dear Sir/Madam,

Sub.: Newspaper advertisement for AGM Notice, E-voting and Book closure

Dear Sir/Madam,

We are submitting herewith the newspaper advertisement for 40th AGM Notice, E-voting and Book closure published in Economic times (All editions) (English) and Financial Express (Ahmedabad - edition) (Gujarati) and Daman Ganga (Vapi / Daman- edition) (Gujarati) on 08.09.21.

Please take the above on record and oblige.

Thanking you,

Yours Faithfully,

For Dolat Investments Limited



Sandeep B
Sandeepkumar G. Bhanushali
Company Secretary & Compliance Officer

Place : Mumbai

Encl: As Above

Economic Times (All editions)
dt - 08/09/21

ro, Micro & More



Remission of Duties and Taxes on Exports (RoDTEP) scheme to be extended to special economic zones and also to export processing zones. Government to allow them to sell goods in domestic tariff area. "We have

submitted a proposal before the government to cover SEZs and EOUs too under the RoDTEP scheme," said EPCES chairman Bhuvnesh Seth, adding that the government has assured that a committee is being set up to look at the issue.

DOLAT INVESTMENTS LIMITED

Regd. Off: Office No. 141, Center Point, Somnath, Daman, Daman & Diu- 396210
Corp. Off: 301-308, Bhagwati House, Plot A/19, Veera Desai Road, Andheri (W), Mum - 400058
Tel.: 91-22-2673 2602; Fax: 91-22-26732642; CIN: L67100DD1983PLC004760;
Website: www.dolatinvest.com; E-mail: post@dolatinvest.com;

NOTICE OF 40TH ANNUAL GENERAL MEETING. REMOTE E-VOTING AND BOOK CLOSURE

NOTICE is hereby given that the 40th Annual General Meeting ("AGM" or "Meeting") of the Members of the Company will be held on, Thursday, 30th September, 2021 at 4.30 p.m. (IST) through Video Conferencing ("VC") / Other Audio Visual Means ("OAVM") facility, to transact the businesses, as set out in the Notice convening the 40th AGM of the Company.

The AGM will be held through VC/OAVM without the physical presence of the Members in view of the continuing Covid-19 pandemic, and in compliance with the General Circulars issued by the Ministry of Corporate Affairs dated 8th April, 2020, 13th April, 2020, 5th May, 2020 and 13th January, 2021 (collectively referred to as "MCA Circulars") and the Securities and Exchange Board of India ("SEBI") Circulars dated 12th May, 2020 and 15th January, 2021.

In compliance with the aforesaid circulars, Notice convening 40th AGM and the Annual Report for the Financial Year 2020-21 has been sent electronically on September 07, 2021, to those Members whose e-mail addresses are registered with the Company / RTA/ Depository Participant(s). Members may note that the 40th AGM Notice and the Annual Report for the Financial Year 2020-21 is also available on the Company's website viz. www.dolatinvest.com.

The Register of Members and Share Transfer Books of the Company will remain closed from Friday, September 24, 2021 to Thursday, September 30, 2021 (both days inclusive) for the purpose of AGM.

Pursuant to Section 108 of the Companies Act, 2013 ("the Act"), read with the relevant Rules under the Act and Regulation 44 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, the Company is pleased to provide the facility to Members to exercise their right to vote by electronic means. This facility of casting votes by a Member using remote e-Voting system before the AGM as well as remote e-Voting during the AGM is being provided through Central Depository Services (India) Limited ("CDSL") e-voting platform (www.evotingindia.com)

The Company has fixed Thursday, 23rd September, 2021 being cut-off date for determining members who shall be entitled to avail the facility of remote e-voting as well as e-voting during the AGM in proportion to their share in the paid up equity share capital of the Company.

The remote e-voting will commence at 9.00 a.m. on Monday, September 27, 2021 and ends 5.00 p.m. on Wednesday, September 29, 2021. The e-voting module shall be disabled by CDSL for voting thereafter.

Members who have cast their vote on resolution(s) by remote e-voting prior to the AGM will also be eligible to participate at the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote on such resolution(s) again.

The detailed instruction for remote e-voting process before the AGM / remote e-voting during the AGM has been given in the notes forming part of the Notice of the Annual General Meeting.

Shareholder will be provided with a facility to attend the AGM through VC/OAVM. The detailed procedure for participation in the meeting through VC/OAVM is given in notes forming part of the Notice of the Annual General Meeting.

Any person who has acquired shares and became members of the Company after dispatch of AGM Notice and holds shares on cut-off date may cast their vote as per instruction provided in the AGM Notice.

If you have any queries or issues regarding attending AGM & e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 and 022-23058542/43.

All grievances connected with the facility for voting by electronic means may be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager, (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Mafatlal Mill Compounds, N M Joshi Marg, Lower Parel (East), Mumbai - 400013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call on 022-23058542/43.

For Dolat Investments Limited
Sd/-

Place : Mumbai
Date : 07th September, 2021

Sandeepkumar G. Bhanushali
Company Secretary

HINDUSTAN AERONAUTICS LIMITED



(A Govt. of India Enterprise)
CIN:L35301KA1963G01001622
Regd. Office: 15/1, Cubbon Road, Bengaluru-560001
Tel.: 080-22320001 E-mail:investors@hal-india.co.in
website: www.hal-india.co.in

NOTICE OF THE 58TH ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the 58th Annual General Meeting (AGM) of the Company will be held on Thursday, September 30, 2021 at 3.00 P.M (IST)

dated
limited
which
11 am
remain
ator
com
1

R

01

om

Date:

16:41

Time

5.00

ing

AC

site

(cl.)

ay,

ue

003

364

on

ORT G
mich

my lar

Act

Edish

eaml

TH a

hal P

BY gr

kespe

respo

o the

Bhoji

its (V

aney

lar U

Inclu

Biosh

kol, Z

tham

lvall

ts fol

ich o

land

ig dr

wher

th th

red t

to dr

ng I

pur b

ff or

the cc

more

e the

justi

rdisl

ners i

no m

a Tre

Pre

!

a

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

!!!!!!!

અમલ્ય સમાચારો

જગતમાં સૌથી વધુ રેકોર્ડેડ આર્ટીસ્ટ : આશા ભોસલે

સૌથી વધુ અને વૈવિધ્યપૂર્ણ ગાનારા ગાયિકા આશા ભોસલેનો જન્મ ૮ સપ્ટેમ્બર, ૧૯૩૩ના રોજ થયો હતો. ૧૯૪૩થી જ દાયકાઓ સુધી કમાલની ગાયકી માણનારા આશાજીએ એક હજારથી વધુ ફિલ્મોમાં ગાયું છે. તે ઉપરાંત અનેક નર્વિટ આલ્બમ્સ, દેશ-વિદેશમાં સોલો કોન્સર્ટમાં ગાયું છે. આશાજીએ ફિલ્મી ગીતો ઉપરાંત પોપ, ગઝલ, ભજન, લોકગીતો, શાસ્ત્રીય ગાયન, કવ્વાલી કે રવીન્દ્ર સંગીત પણ ગાયું છે. હિન્દી ઉપરાંત વીસેક ભાષાઓમાં પણ ગાયું છે. ૨૦૦૬માં આશાજીએ કહ્યું હતું કે તેમણે ૧૨ હજારથી વધુ ગીતો ગાયા છે. ત્યારબાદ અનેક સાધનો દ્વારા આ માહિતીને પુષ્ટિ મળી હતી. ૨૦૧૧માં સંગીત જગતના ઈતિહાસમાં સૌથી વધુ રેકોર્ડેડ આર્ટિસ્ટ રૂપે તેમનું નામ ગુનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં ચમકે છે. ભારત સરકારે તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડથી ૨૦૦૦ ના વર્ષમાં નવાજ્યા હતાં, તો ૨૦૦૮માં તેમને પદ્મવિભૂષણ એનાયત થયું હતું. ૨૦૧૩માં આશાજીએ 'માઈ' ફિલ્મમાં અભિનય કર્યો હતો અને તેમના અભિનયની સરાહના પણ કપડી હતી.



મહારાષ્ટ્રના ત્યારના રજવાડા સાંગલીમાં રંગભૂમિના અભિનેતા અને શાસ્ત્રીય ગાયક દીનાનાથ મંગેશકરના સંગીતમય ગોમાંતક મરાઠા પરિવારમાં જન્મેલા આશાજી સ્વરકિન્નરી લતા મંગેશકરના નાના બેન છે. પરિવાર માટે લતા-આશાએ ફિલ્મોમાં ગાઈને અભિનય કરવો પડ્યો હતો. દસ વર્ષની વયે મરાઠી ફિલ્મ 'માન્ડે બાળ' માં 'ચલા ચલા નવ બાલા' ગીત આશાજીએ ૧૯૪૩માં ગાયું હતું. હિન્દી ફિલ્મ 'યુનરિયા'માં પહેલીવાર 'સાવન આયા' ગીતમાં ૧૯૪૮માં કંઠ આપ્યો હતો. તેમનું પહેલું સોલો ફિલ્મી ગીત 'રાત કી રાની' ૧૯૪૮માં ગાયું હતું. પરિવારની ઈચ્છા વિરુદ્ધ ૧૬ વર્ષની વયે ૩૧ વર્ષના ગણપતરાવ ભોસલે સાથે તેઓ પરણ્યા હતાં.

બર્મન (પંચમ) તેમને મળ્યાં હતા. પંચમના સંગીતમાં પહેલી વાર આશાજીએ 'તીસરી મંજીલ'માં ગાયું હતું. કહે છે કે 'તીસરી મંજીલ'ના 'આજા આજા મે હું પ્યાર તેરા' ગીત ગાવાની આશાજીએ પહેલાં તો એટલા માટે ના પાડી હતી કે આનું પાટિય ગીત તેઓ ગાઈ ન શકે. રાહુલદેવે તેની પૂન બદલવાની તૈયારી બતાવી હતી પણ આશાજીએ તેને સ્વીકારતાં પકાર ઝીલવાનું પસંદ કર્યું હતું. દસ દિવસના રીયાઝ બાદ 'આજા આજા' રેકોર્ડ થયું હતું. રફી સાહેબ સાથેના આ તેમજ 'ઓ હસીના જુલ્કોવાલી' અને 'ઓ મેરે સોના રે' ત્રણે યુગલ ગીતો આજે પણ ગવાય છે. એકવાર શમ્મી કપૂરે તો ત્યાં સુધી કહ્યું હતું કે 'જો મને મારા ગીતો ગાવા માટે મોહમ્મદ રફી ન મળ્યા હોત તો મેં તે કામ આશા ભોસલે પાસે કરાવ્યું હોત.'

ત્યાર બાદ રાહુલદેવ બર્મન અને આશા ભોસલેની આ જોડીએ અસંખ્ય કેબ્રે, રોક, ડિસ્કો, ગઝલ અને શાસ્ત્રીય રચનાઓ આપી. અભિનેત્રી-નર્તકી હેલેન પર 'ઓ હસીના જુલ્કોવાલી' ચિત્રિત થયું હતું. કહે છે કે હેલેન તેમના આશાજીએ ગાયેલાં ગીતોના રેકોર્ડિંગમાં પણ હાજર રહેતાં, જેથી તેઓ ગીતને વધુ સારી રીતે સમજ શકે અને પોતાના નર્તનમાં જાન રેડી શકે. રાહુલદેવ-આશા-હેલેનની ટોળકીએ ત્યાર બાદ 'કારવા'નો વિખ્યાત કેબ્રે 'પિયા તું અબ તો આજા' અને 'ડોન'ની 'ધે મેરા દિલ' જેવી ભલકતી રચનાઓ આપીને યાદગર સંગીત રચ્યું છે. તેજ રીતે રાહુલદેવ અને આશાજીના 'દમ મારો દમ', 'કુરા લિયા હે તુમને', 'દુનિયા મે', 'જાને જાં', 'ભલી ભલી સી એક સુરત' ને નભી શકાય. આશા-કિશોરના પંચમ સર્જિત યુગલ ગીતોનો ભવ્ય ભૂતકાળ છે. પંચમના 'ઈજાજત'ના 'મેરા કુછ સામાન'ને ગાવા બદલ આશાજીને નેશનલ એવોર્ડ મળ્યો હતો. ૧૯૮૦માં તેઓ પરણ્યા અને એ સંબંધ પંચમના જીવનના અંત સુધી રહ્યો. એક સમયે 'કેબ્રે ગાયિકા' અને 'પોપ ફૂનર' પર કેટલો ઓળખાયેલા આશા ભોસલેએ ૧૯૮૧માં રેખાના અભિનયવાળી 'ઉમરાવ જાન'માં ગઝલો ગાઈ. પૈયામના સંગીતમાં આશા ભોસલેએ ગાયેલી મહાન રચનાઓ 'દિલ થીકા પી ક્યેરી', 'ઈન આંખો કી મસ્તી કે', 'ધે ક્યા જગલ હે દોસ્તો' કે 'જુસ્તજુ જિસકી થી' ભારતીય સિને સંગીતનો વારસો બની રહી છે. પૈયામે આ ગીતો માટે આશાની ગાયકીની પીચ અડધો સુર નીચી કરી હતી અને ખુદ આશાજીને અલગ રીતે ગાવાનો એહસાસ થતાં તેમણે આથી વ્યક્ત કર્યું હતું. 'ઉમરાવ જાન'ની રચનાઓ ગાવા માટે આશાજીને નેશનલ એવોર્ડ મળ્યો હતો. તેના થોડા વર્ષો બાદ રાહુલદેવના સંગીતમાં 'ઈજાજત' (૧૯૮૭)ના 'મેરા કુછ સામાન' માટે આશાજીને બીજો નેશનલ એવોર્ડ મળ્યો હતો. જેમાંલગાન (૨૦૦૧)નું 'રાધા કેસે ન જલે', 'પ્યાર તુને ક્યા કિયા' (૨૦૦૧)નું 'કમબખ્ત ઈશક', 'ફિલકાલ' (૨૦૦૨)નું 'ધે લક્ષ્મી', 'લકી' (૨૦૦૫)નું 'લકી લીસા' યાદ કરી શકાય. ઓક્ટોબર, ૨૦૦૪માં 'વેરી બેસ્ટ ઓફ આશા ભોસલે - ૬ કવીન ઓફ બોલીવુડ' નામનું આલ્બમ આપ્યું જેમાં આશાજીના ૧૯૬૬થી ૨૦૦૩ના આલ્બમ અને ફિલ્મના ગીતોનો સંચય હતો. ૨૦૧૨માં આશાજી ટીવી પરના રીયાલીટી શો 'સુર શેન'ના નીણવટીકાર રૂપે દેખાતાં હતાં.

આશા ભોસલેના યાદગર ગીતો :
નઝર લાગી રાજા (કાલા પાની), જાઈયે આપ કહાં જાયે (મેરે સનમ), ઊંઝ જબ જબ જુલ્કે તેરી (નયા દોર), ઓ હસીના જુલ્કોવાલી (તીસરી મંજીલ), પાન પામે સેયા હમ્માર (તીસરી કસમ), પિયા તું અબ તો આજા (કારવો), પરદે મેં રહને દો (શિકાર), પિયા બાવરી (પુનસુરત), ઈન આંખો કી મસ્તી કે (ઉમરાવ જાન), લુત્તા લિયા હે તુમને (જો દિલ કો (યાદો કી બારાત), રાત બાકી (નમક હલાલ), યે મેરા દિલ પ્યાર કા દીવાના (ડોન), મેરા કુછ સામાન (ઈજાજત). **નરેશ કપડીઆના 'સપ્ટેમ્બરના સિતારા' પુસ્તકમાંથી**

ચીપલીમાં મોસમનો કુલ વરસાદ ૪૨ ઈંચ નોંધાયો

ચીપલી તા.૭ : ચીપલી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસથી ધીમી ગતિએ વરસાદ થતાં ડાંગરના પાકને વધુ માફક વરસાદ રહ્યો છે જ્યારે શાકભાજીના પાકને પણ આ વરસાદ ને લઈ રાહત થવા પામી છે ત્યારે ચીપલી ફલ્સ કંટ્રોલ માં અત્યાર સુધીમાં ૪૨ ઈંચ જેટલો વરસાદ નોંધાવા પામ્યો છે. ચીપલી તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી મોસમનો સરેરાશ વરસાદ ૬૦ થી ૭૦ ઈંચ જેટલો રહેતો હોય છે

હવામાન સમાચાર (કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેલી)						
હવામાન આગાહી (તા.૦૮ સપ્ટેમ્બર થી ૧૨ સપ્ટેમ્બર - ૨૦૨૧)						
અનુ. નં.	હવામાન પરિમાણો	દિવસ-૧ (૦૮/૦૯)	દિવસ-૨ (૦૯/૦૯)	દિવસ-૩ (૧૦/૦૯)	દિવસ-૪ (૧૧/૦૯)	દિવસ-૫ (૧૨/૦૯)
૧.	વરસાદ (મી.મી.)	૧૦૦	૧૬૭	૨૬	૬૪	૬૮
૨.	મહત્તમ તાપમાન (સે.ગ્રે.)	૩૨	૩૧	૩૦	૩૧	૩૧
૩.	લઘુતમ તાપમાન (સે.ગ્રે.)	૨૬	૨૫	૨૫	૨૬	૨૬
૪.	મહત્તમ ભેજ (%)	૮૬	૮૫	૮૩	૮૪	૮૪
૫.	લઘુતમ ભેજ (%)	૮૮	૮૧	૮૬	૮૮	૮૮
૬.	પવનની ગતિ (કિ.મી./કલાક)	૭.૭	૧૬.૭	૨૦.૭	૧૮.૮	૧૬.૨
૭.	પવનની દિશા (કમ્પાસ પોઈન્ટ)	દ.પશ્ચિમ	દ.પશ્ચિમ	દ.પશ્ચિમ	દ.પશ્ચિમ	દ.પશ્ચિમ

વધુ માગદર્શન માટે ખેડૂતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અંબેલીનો સંપર્ક કરી શકે છે

ઓરવાડ તાલુકા આરોગ્ય કચેરીમાં રસીકરણ અંગે સમીક્ષા કરાઈ



વલસાડ, તા. ૦૭ : જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ, મનીષ ગુરુવાની દ્વારા પારડી તાલુકાના ઓરવાડ પાલિકા આરોગ્ય કચેરીની મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા આયોજન સહ તાલુકા વિકાસ અધિકારી સાથે મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં રસીકરણ કામગીરીની સમીક્ષા અંગે

દોલત ઈન્વેસ્ટમેન્ટ્સ લીમીટેડ
 સુપર સેક્યોરિટી : ૩૦% - ૩૦% (સેક્યોરિટી), ૩૦% - ૩૦% (સેક્યોરિટી), ૩૦% - ૩૦% (સેક્યોરિટી)
 ટેલિ: ૯૧-૨૨-૨૬૭૩ ૨૬૦૮, ફેક્સ : ૯૧-૨૨-૨૬૭૩૨૬૨૧, CIN : L67100DD1983PLC004760
 વેબસાઇટ : www.dolainvest.com, ઈ-મેઇલ : info@dolainvest.com

૪૦મી વાર્ષિક સાધારણ સભા, રીમોટ ઈ-વોટીંગ અને ભુક કલોઝર માટેની નોટિસ

અનેકો નોટિસ આપવામાં આવે છે કે, કંપનીની ૪૦મી એજન્ટમેન્ટ માટેની નોટિસ મુજબના કામે કંપનીના સભ્યોની ૪૦મી વાર્ષિક સાધારણ સભા (અનુચિત અથવા બેકગ્રાઉન્ડ ("VOC")) અથવા ઓફિસીયલ વિઝ્યુઅલ મિસ્ટ ("OAVM") સવલત મારફતે તા.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ ને ગુરુવારે સાંજે ૪:૩૦ (IST) કલાક યોજાશે.

આ એજન્ટમેન્ટ કોવિડ-૧૯ પેન્ડેમિક અને મિનીસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સ દ્વારા જારી તા.૮મી એપ્રિલ ૨૦૨૦, ૧૩મી એપ્રિલ ૨૦૨૦ અને ૧મી મે ૨૦૨૦ અને ૧૩મી જાન્યુઆરી ૨૦૨૧ (સંયુક્ત રીતે 'એમસીએ પરિષદો') તરીકે ઉલ્લેખિત) અને કોવિડ-૧૯ એન-એક્સપેન્સિવ ઓફ ઈન્ડિયા (સીબી) દ્વારા જારી તા. ૧૨મી મે ૨૦૨૦ અને ૧૫મી જાન્યુઆરી ૨૦૨૧ના પરિષદો મુજબ સભ્યોની ભૌતિક હાજરી વગર VOC/OAVM મારફતે યોજાશે.

ઉપરોક્ત પરિષદો મુજબ ૪૦મી એજન્ટમેન્ટ અંગેની નોટિસ અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧ના વાર્ષિક અહેવાલ તા.૭મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના જે સભ્યોના ઈ-મેઇલ એડ્રેસ કંપનીના RTA/ ડિપોઝિટરી પાર્ટીસિપર(સુ) પાસે નોંધાયેલા છે તેમને ઈલેક્ટ્રોનિક્સ મોડેલ આપવામાં આવશે. સભ્યો એ પછ નોંધ લે છે, ૪૦મી એજન્ટમેન્ટ નોટિસ અને નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧નો વાર્ષિક અહેવાલ કંપનીની વેબસાઇટ www.dolainvest.com પર પણ ઉપલબ્ધ છે.

એજન્ટમેન્ટ હેતુથી સભ્યોનું રજીસ્ટર અને કંપનીની શેર ટ્રાન્સફર બુક શુક્રવાર તા.૨૪ સપ્ટેમ્બર ૨૦૨૧ થી ગુરુવાર તા.૩૦ સપ્ટેમ્બર ૨૦૨૧ (બંને દિવસો સહિત) બંધ રહેશે.

સેબી (લિસ્ટિંગ ઓફ ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ડીલ્સ)ના રીગ્યુલેટરી ફ્રેમવર્કમાં ૨૦૧૧ના રેગ્યુલેશન ૪૩ને અનુસરતાં અને કંપનીના એક્ટ, ૨૦૧૩ ('ધ એક્ટ')ના સેક્શન ૧૦૮ને એક્ટના સંબંધિત નિયમો સાથે વાંચતાં કંપનીના સભ્યોને તેમના માતાપિતા/કરોડીનર/સહી માટે આપવાની સવલત પૂરી પાડતાં આનંદ અનુભવે છે. રીમોટ ઈ-વોટીંગ સિસ્ટમના ઉપયોગથી સભ્યો માત્ર આપવાની આ સવલત એજન્ટમેન્ટ પહેલાં જ જ રીતે એજન્ટમેન્ટ દરમિયાન ઈ-વોટીંગની સવલત સેટ્વલ ડિપોઝિટરી સર્વિસ (ઈ-વોટ) લીમીટેડ ("CDSL") ઈ-વોટીંગ પ્લેટફોર્મ www.dolainvest.com મારફતે પૂરી પડશે.

કંપનીના પેઈડ અપ ઈન્વેસ્ટીંગ શેર મૂલ્યમાં તેમના શેરના પ્રમાણ મુજબ એજન્ટમેન્ટ દરમિયાન ઈ-વોટીંગ, એ જ રીતે રીમોટ ઈ-વોટીંગની સવલત મેળવવા માટે કોલ લાઇફ સમય છે તે નક્કી કરવા માટેની ૬૨-ઓફ-ટોઈ ગુરુવાર તા. ૨૩મી સપ્ટેમ્બર, ૨૦૨૧ કંપનીએ નક્કી કરી છે.

રીમોટ ઈ-વોટીંગ સોમવાર, તા.૨૦મી સપ્ટેમ્બર, ૨૦૨૧ના સવારે ૯:૦૦ કલાક થયે શરૂ થશે અને બુધવાર તા.૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૧ના સાંજે ૫:૦૦ કલાક પૂર્ણ થશે. ત્યારબાદ મતદાન માટે CDSL દ્વારા ઈ-વોટીંગ મોડ્યુલ નિષ્ક્રિય કરી દેવાશે.

જે સભ્યોએ રીમોટ ઈ-વોટીંગ દ્વારા એજન્ટમેન્ટ પહેલાં હસ્તાક્ષર (નો) અંગે તેમનો મત આપી ઘોષણા હોય તેઓ VOC/OAVM મારફતે એજન્ટમેન્ટ બાબ લેવા માટે લાઇફ હશે તેવો તેઓ કરી શકે એ દરખાસ્ત (નો) પર તેમનો મત આપી શકશે નહીં.

એજન્ટમેન્ટ પહેલાં ઈ-વોટીંગની પ્રક્રિયાએજન્ટમેન્ટ દરમિયાન રીમોટ ઈ-વોટીંગ માટેની વિગતવાર સૂચના વાર્ષિક સાધારણ સભાની નોટિસના નોટિસમાં ભાગમાં આપી દેવાયેલી છે.

શેરહોલ્ડરને VOC/OAVM મારફતે એજન્ટમેન્ટ હાજરીની સવલત પૂરી પાડવામાં આવશે. VOC/OAVM મારફતે નિર્ધારિત ભાગ લેવા માટેની વિગતવાર પ્રક્રિયા વાર્ષિક સાધારણ સભાની નોટિસના નોટિસ કોર્પોરેટ પાર્ટીસિપરમાં આપવામાં આવેલ છે.

જે કોઈ પણ વ્યક્તિ એજન્ટમેન્ટ માટેની નોટિસ મોકલવા પછી કંપનીના સભ્ય બનવા હોય અને શેરો મેળવવા હોય અને ૬૨-ઓફ-ટોઈના રીમોટ ઈ-વોટીંગ દ્વારા હોય તેવા સભ્યો તેમના મતો એજન્ટમેન્ટ નોટિસમાં પૂરી પાડવામાં આવેલી સૂચનાઓ મુજબ તેમના મત આપી શકશે.

જો તેમને એજન્ટમેન્ટમાં હાજર રહેવા અને CDSL ઈ-વોટીંગ સિસ્ટમથી ઈ-વોટીંગ અંગે કોઈ પુછપૂછ કરે તો તેમને ૬૨-ઓફ-ટોઈના રીમોટ ઈ-વોટીંગ દ્વારા હોય તેવા સભ્યો તેમના મતો એજન્ટમેન્ટ નોટિસમાં પૂરી પાડવામાં આવેલી સૂચનાઓ મુજબ તેમના મત આપી શકશે.

ઈલેક્ટ્રોનિક્સ સાધન દ્વારા મતદાન માટેની સવલત સંબંધી તમામ ફરિયાદો શ્રી રાકેશ દળવી, સિ.ની. મેનજર, (CDSL) સેટ્વલ ડિપોઝિટરી સર્વિસ (ઈન્ડિયા) લિમિટેડ, એન્-લિંગ, ૨૫મો માળ, મારાઓન કમ્પ્લેક્સ, મહાલાલ મિલ કમ્પાઉન્ડ, એન.એમ. જોશી માર્ગ, લોહર પર્વેલ (ઈ), મુંબઈ-૪૦૦૦૧૭ અને કોઈ શકે છે અથવા helpdesk.evoting@cdslindia.com ને ઈમેઇલ લખી અથવા ૦૨૨-૨૩૦૫૮૫૬૪ ૪૩ ને ફોન કરી શકે છે.

દોલત ઈન્વેસ્ટમેન્ટ લીમી. વતી,
 Sd/-
 સંદિપકુમાર જી. ભાગ્યાશાલી (કંપની સેક્રેટરી)

કે.ટી. ઈટાલિયા (GAS), સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ ધરમપુરની કોર્ટમાં,
અરજદાર : નિલેશભાઈ ગુનુભાઈ ભોયા
 રહે. ખાંડ ગાંવિત ફળિયુ, તા.ધરમપુર

વિરુદ્ધ
સામાવાણ : જન્મ મરણ નોંધણી અધિકારીશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત, ખાંડ

જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ની કલમ ૧૩(૩) અનુચ્છે જન્મની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજ અનુચ્છે નોટીસ

આથી લાગતા વળગતા ઈસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજ કરેલ છે કે, નિલેશભાઈ ગુનુભાઈ ભોયા, રહે. ખાંડ ગાંવિત ફળિયુ, તા.ધરમપુર, જી.વલસાડનાઓએ તેમની પુત્રી નેશબેન નિલેશભાઈ ભોયાનો જન્મ તા.૦૬/૦૧/૨૦૧૬ના રોજ મોજે ખાંડ, તા.ધરમપુર, જી.વલસાડ મુકામે થયેલ છે. તેમના જન્મની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતનુકૂળી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર જન્મની નોંધણી કોર્ટને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ધરમપુર, પ્રાંત કચેરી, ધરમપુર, જી.વલસાડની કચેરીએ વાંધો રજૂ કરવાના રહેશે. જો વાંધો નહીં આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી.

આજરોજ તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

નં. એમએજ/મરણ/૨૭ નં. ૨૪/૨૦૨૧
 સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ, ધરમપુરની કચેરી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધરમપુર, તા.ધરમપુર, જિલ્લા.વલસાડ

કોર્ટનો સિક્કો (કેટલુ ટી. ઈટાલિયા) સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ, ધરમપુર

કે.ટી. ઈટાલિયા (GAS), સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ ધરમપુરની કોર્ટમાં,
અરજદાર : જયંતિભાઈ શીવભુભાઈ માહલા
 રહે. બિલપુડી, સિમાગ ફળિયા, તા.ધરમપુર

વિરુદ્ધ
સામાવાણ : જન્મ મરણ નોંધણી અધિકારીશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત, બિલપુડી

જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ની કલમ ૧૩(૩) અનુચ્છે મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજ અનુચ્છે નોટીસ

આથી લાગતા વળગતા ઈસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજ કરેલ છે કે, અરજદારશ્રી જયંતિભાઈ શીવભુભાઈ માહલા, રહે. બિલપુડી, સિમાગ ફળિયા, તા.ધરમપુર, જી.વલસાડનાઓએ તેમના પિતા સ્વ. શીવભુભાઈ લખનાભાઈ માહલાનું મરણ તા.૧૦/૦૨/૧૯૮૮ના રોજ મોજે બિલપુડી, સિમાગ ફળિયા, તા.ધરમપુર, જી.વલસાડ મુકામે થયેલ છે. તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતનુકૂળી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોર્ટને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ધરમપુર, પ્રાંત કચેરી, ધરમપુર, જી.વલસાડની કચેરીએ વાંધો રજૂ કરવાના રહેશે. જો વાંધો નહીં આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી.

આજરોજ તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

નં. એમએજ/મરણ/૨૭ નં. ૦૮/૨૦૨૧
 સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ, ધરમપુરની કચેરી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધરમપુર, તા.ધરમપુર, જિલ્લા.વલસાડ

કોર્ટનો સિક્કો (કેટલુ ટી. ઈટાલિયા) સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ, ધરમપુર

કે.ટી. ઈટાલિયા (GAS), સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ ધરમપુરની કોર્ટમાં, અરજદાર : જયંતિભાઈ શીવભુભાઈ માહલા રહે. બિલપુડી, સિમાગ ફળિયા, તા.ધરમપુર

વિરુદ્ધ સામાવાણ : જન્મ મરણ નોંધણી અધિકારીશ્રી અને તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત, બિલપુડી

જન્મ-મરણ અધિનિયમ-૧૯૬૯ની કલમ ૧૩(૩) અનુચ્છે મરણની નોંધ કરાવવા માટેનો હુકમ મેળવવા માટેની અરજ અનુચ્છે નોટીસ

આથી લાગતા વળગતા ઈસમોને જણાવવાનું કે, અરજદારે જન્મ-મરણ અધિનિયમ હેઠળ અરજ કરેલ છે કે, અરજદારશ્રી જયંતિભાઈ શીવભુભાઈ માહલા, રહે. બિલપુડી, સિમાગ ફળિયા, તા.ધરમપુર, જી.વલસાડનાઓએ તેમના પિતા સ્વ. શીવભુભાઈ લખનાભાઈ માહલાનું મરણ તા.૧૦/૦૨/૧૯૮૮ના રોજ મોજે બિલપુડી, સિમાગ ફળિયા, તા.ધરમપુર, જી.વલસાડ મુકામે થયેલ છે. તેમના મરણની નોંધણી જે તે વખતે કાયદાથી અજાણ હોઈ ભૂલ અને શરતનુકૂળી કરવાની રહી ગયેલ છે. જેથી અત્રેની કોર્ટમાં અરજ દાખલ કરેલ છે. સદર મરણની નોંધણી બાબતે કોર્ટને વાંધો યા તકરાર હોય તો પોતે અથવા વકીલ મારફત સદરહુ જાહેરાત પ્રસિદ્ધ થયા તારીખથી ૩૦ દિવસની અંદર સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ધરમપુર, પ્રાંત કચેરી, ધરમપુર, જી.વલસાડની કચેરીએ વાંધો રજૂ કરવાના રહેશે. જો વાંધો નહીં આવે તો વાંધો નથી તેમ માની આગળની કાર્યવાહી કરવામાં આવશે. જેની તમામ લાગતા વળગતા ઈસમોએ નોંધ લેવી.

આજરોજ તા.૦૨/૦૮/૨૦૨૧ના રોજ મારી સહી તથા કોર્ટનો સિક્કો કરીને આપ્યો.

નં. એમએજ/મરણ/૨૭ નં. ૦૮/૨૦૨૧
 સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ, ધરમપુરની કચેરી, તાલુકા સેવા સદન, પ્રથમ માળ, ધરમપુર, તા.ધરમપુર, જિલ્લા.વલસાડ

કોર્ટનો સિક્કો (કેટલુ ટી. ઈટાલિયા) સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટ, ધરમપુર

DOOR TO DOOR SERVICE

EZ Clean CAR WASH
 INTERIOR & EXTERIOR

OUR SERVICES

- STEAM WASH
- BODY POLISH/SHINING
- DASHBOARD CLEANING
- LEATHER/FABRIC CONDITIONING
- SOFA STEAM & VACUUM CLEANING
- OFFICE SPACE CLEANING

HOME SERVICE
OFFICE, SOFA & CARPET CLEANING

To Book an appointment call : **7567190447, 7284002401**

જાહેર નોટીસ
સબ ડિવિઝનલ મેજસ્ટ્રેટશ્રી વલસાડની કોર્ટમાં, મું. વલસાડ
 નં. એમએજ/જન્મમરણ/૨૭ નં. ૨૦૩/૨૦૨૧

અરજદાર : લક્ષ્મીબેન મનુભાઈ નાયક
 રહે. સેગવા, સડક ફળિયા, તા.જી. વલસાડ

વિરુદ્ધ
સામાવાણ : તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામ પંચાયત સેગવા

ઉપરોક્ત અરજદારે તેમના દાદી સાસુ સ્વ. બાણકીબેન નરસંઈભાઈ નાયકાનું મરણ મોજે-કુવા ફળિયા, તા.જી.વલસાડ ખાતે તા.૧૭/૦૧/૧૯૬૭ ના રોજ મોજે-સેગવા, તા.જી.વલસાડ મુકામે થયેલ હોવા અંગેની ઉપરોક્ત અરજદારના દાદી સાસુના મરણની નોંધણી કરવા અત્રેની કચેરીમાં અરજ કરેલ છે. જે વાસ્તે જે કોર્ટને અરજ વિરુદ્ધ વાંધો હોય તેમણે દિન-૧૫માં વાંધો અત્રેની કોર્ટમાં રજૂ કરવા, વાંધા ન રજૂ થયેથી અરજ મંજૂર